



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૨૨-૨૦૨૫ માટે નવા હોદ્દાઓની નિયુક્તિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ...

વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વર્ષ ૨૦૨૨-૨૦૨૫ માટે કારોબારી સમિતિના ૨૪ સભ્યો બીન હરીફ થતા તેમાંથી ૫ હોદ્દાઓની વરણી કરવા માટેનો કાર્યક્રમ તા.૨૧-૨-૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં આર્સ વિદ્યામંદીર-મુંજકાના શ્રી પરમાત્માનંદ સ્વામીજી, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, શ્રી રમણીકભાઈ જસાણી, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી જ્યેશભાઈ બોધરા, ચુંટણી સમિતિના ચેરમેનશ્રી હિતેષભાઈ બગડાઈ, સભ્યશ્રી સુનિલભાઈ શાહ, શ્રી આર. એમ. વારોતરીયા સાહેબ, આમંત્રીત સભ્યશ્રી રામભાઈ બરછા, શ્રી પરષોતમભાઈ પીપળીયા, ચેમ્બરના પુર્વ પ્રમુખશ્રી જયંતભાઈ દેસાઈ, શ્રી હિરાભાઈ માણેક, શ્રી ધિરૂભાઈ વિઠલાણી, શ્રી જીતુભાઈ દેસાઈ, શ્રી સમીરભાઈ શાહ, શ્રી શિવલાલભાઈ બારસીયા, શ્રી ગૌતમભાઈ ધમસાણીયા, જામનગર ચેમ્બરના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખશ્રી કિરીટભાઈ સોની, બનાસકાંઠા ચેમ્બરના પ્રમુખશ્રી શિવરામભાઈ પટેલ, જામનગર ગ્રેઈન મર્યેન્ટ એસોસીએશનના પ્રમુખશ્રી જીતુભાઈ લાલ તથા બહોળી સંખ્યામાં શહેરના ૮૦ જેટલા વિવિધ એસોસીએશનોના હોદ્દેદારોશ્રીઓ હાજર રહેલ.

ચુંટણી સમિતિના ચેરમેનશ્રી હિતેષભાઈ બગડાઈએ બીનહરીફ થયેલ ૨૪ કારોબારી સભ્યોને શપથ લેવડાવેલ. ત્યારબાદ નવા હોદ્દેદાર તરીકે પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા, માનદત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, માનદ્ સહમંત્રીશ્રી ઉત્સવભાઈ દોશી તથા ખજાનચીશ્રી વિનોદભાઈ કાછડીયાને જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પી અભિવાદન કરાયેલ.

કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ સૌને સહય્ય આવકારી રાજકોટ ચેમ્બરના વિશાળ ફૂલક અને ચેમ્બર દ્વારા કરાયેલ સફળ કામગીરીનો અહેવાલ આપેલ. તેમજ કારોબારી સમિતિની ચુંટણી માટેનો જે કાર્યભાર સોંપવામાં આવેલ તે ચુંટણી સમિતિને પણ બિરદાવેલ. તેમજ તમામ વેપાર-ઉદ્યોગકારો, વિવિધ એસોસીએશનો અને પ્રેસ-મિડીયાઓ તથા શુભેચ્છકોએ જે સાથ અને સહકાર આપેલ છે. તે તમામનો આભારની વ્યક્ત કરેલ. સાથો સાથ કોઈપણ સભ્યો કે એસોસીએશનોને પ્રશ્નો કે સમસ્યાઓ હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા જેથી તેની સરકારશ્રીમાં રજુઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું. આવનારા દિવસોમાં શહેરના ૧૧ જેટલા વિવિધ એસોસીએશનોને બોર્ડમાં આમંત્રીત સભ્ય તરીકે આવરી લેવામાં આવશે તથા

શહેરના તમામ એસોસીએશનનોને ફેડરેશનમાં આવરી લઈ એક જુથ બની વાણઉકેલ પ્રશ્નોનું કેન્દ્ર સરકારમાં રજુઆત કરી તેનું સચોટ અને યોગ્ય નિરાકરણ કરીશું તેમ જણાવેલ.

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આર્સ વિદ્યામંદિર-મુંજકાના શ્રી પરમાત્માનંદ સ્વામીજીએ આજના આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપેલ તે બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યક્ત કરી સૌ ઉપસ્થિતને આશીર્વાચન આપેલ.

ત્યારબાદ વિવિધ એસોસીએશનમાંથી પધારેલ હોદ્દાઓએ રાજકોટ ચેમ્બરના નવા નિયુક્ત થયેલ હોદ્દાઓનું સન્માન કરેલ. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ચેમ્બરના તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવેલ. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.